



સંપાદકની કલમે



સારસ્વત મિત્રો, નમસ્કાર સૌ કુશળ હશો. ૨૦૨૦નું વર્ષ માનવ ઇતિહાસમાં અલગ રીતે યાદ રહેવાનું છે. પરીક્ષાઓની મોસમ ખીલે ત્યાં તો કોરોનાની મહામારીનું આગમન થઈ ચૂક્યું હતું. પરિણામે વ્યાવસાયિક જીવનની વ્યસ્તતા કોરાણે મૂકી સૌ કોરોના સામેની જંગમાં લોકડાઉન થઈ ગયા. આ એક ધારીના હોય તેવી અનુભૂતિ હતી. જો કે આનંદ એ વાતનો છે કે સૌ સંગઠિત થઈને પરિસ્થિતિ સામે સકારાત્મક રીતે વિવિધ વ્યૂહ સાથે લડ્યા. આ સમય સૌ માટે કપરો હશે! પણ સર્જન, વિસર્જન અને નવસર્જનએ પ્રકૃતિનો ક્રમ રહ્યો છે. સદભાગ્યે બૌદ્ધિકવર્ગ શું કરવું અને શું ન કરવું તેનાથી જ્ઞાત હોય છે. તેથી બહારની યાત્રાઓ અટકી તો તેથી વિશેષ મહત્વની અંતરની યાત્રા શરૂ થઈ. જેમાં વાચન, લેખન અને ચિંતન કરવાથી આપણે અંદરથી વધુ મજબૂત થયા. આ અનુભવ પરિવાર અને સમાજના કામમાં આવશે..

શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા શિક્ષકથી લઈ સરકાર સુધી દરેકને થઈ. જેના કારણે દૂરદર્શન, યુ ટ્યુબ, ફેસબુક, ગુગલ ક્લાસ, ઝૂમ, વોટ્સએપ, ઈ-બુક ના માધ્યમથી શિક્ષણને ચેતનવંતુ રાખ્યું. આ પ્રયોગો હતા પણ એની ઉપયોગિતા કાયમી છે. આ અનુભવોને રોજંદા શિક્ષણમાં પણ શામેલ કરવાથી લાભ થશે.

હેવે સૌએ પોતાના કાર્યમાં જોડાઈને ગતિશીલ બનવાનો સમય શરૂ થાય છે. શિક્ષિત વ્યક્તિ અનુભવોમાંથી શીખે છે અને તદાનુસાર જીવે. ગત સમયમાં આપણને આપણી મર્યાદાઓની અનુભૂતિ થઈ ચૂકી છે. સાથોસાથ સ્વચ્છતા, દેશ પ્રેમ, દાન, સમાજસેવા, જીવદયા અને આરોગ્ય જેવા મૂલ્ય અનુભવાયા છે. સાથોસાથ સંગઠિત થઈ સંયમમાં રહી મોટી આપદાને પણ માત આપી શકાય છે. આ બોધ લઈ આપણે આપણા જીવન ધ્યેયો તરફ સકારાત્મક રીતે આગળ વધવું પડશે.

મિત્રો, વ્યાવસાયિક કે અભ્યાસકીય વ્યસ્તતામાંથી જયારે પણ સમય મળે ત્યારે વિચાર પ્રક્રિયા શરૂ કરવાનો કીમિયો અજમાવવો જોઈએ. આમ કરવાથી સર્જનાત્મકતા વધશે, સમસ્યાની સાચી સમજ કેળવાશે, સંશોધન દ્રષ્ટિએ તપાસ કરશો તો વાજબી ઉકેલ મેળવશો આ બધું આનંદદાયક બનશે.

શિક્ષણ દર્શન ઉત્તમ વાચન સ્ત્રોત છે. જેમાં લેખકો સાંપ્રત વિષયો પર રોચક શૈલીમાં કંઈક નવું સર્જન કરી, શોધી આપણી સામે રજૂ કરે છે. આ આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. આવી વિદ્યા પ્રાપ્તિ ખરાં અર્થમાં સૌ માટે કલ્યાણકારી બની શકે છે.